

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ છ નવા સભ્યોને સમાવે છે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 29, 2022) – દર વર્ષે, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ (BSHF) બ્રેમ્પટનમાં સ્પોર્ટના વિકાસમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર લોકોની ઉપલબ્ધિઓની ઉજવણી કરે છે. બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ વર્ષ 2022 માં, સ્પોર્ટમાં ઉત્કૃષ્ટતા બદલ છ નવા સભ્યોને આવકારે છે.

ફ્રેન્ક ફાસિયા (Frank Fascia) ને બેઝબોલમાં પોતાના સમર્પણ બદલ બિલ્ડર શ્રેણીમાં સમાવવામાં આવશે. તેમણે વર્ષ 1983 માં બ્રેમ્પટનમાં સગીર વયે બેઝબોલ રમવાનું શરૂ કર્યું, અને NCAA માં રમવાનું ચાલુ કર્યું. તેઓ વર્ષ 1991 માં બ્રેમ્પટન સીનિયર ટ્રિવનસના સંસ્થાપક સભ્ય હતા, તેમણે 2007 માં બ્રેમ્પટન માર્શનર બેઝબોલ ઈન્ક.ને કોચિંગ આપ્યું હતું અને તેમણે COBA અને બેઝબોલ ઓન્ટેરિયો સાથે વિવિધ પદોએ સેવા આપી છે. વર્ષ 2022 માં, તેમની નિયુક્તિ શેરિડેન કોલેજમાં ઉદ્ઘાટક બેઝબોલ ટીમના મુખ્ય કોચ તરીકે થઈ હતી.

પ્રેઈમ્નોથ (પ્રેઈમ) પરસૌદ (Pramnauth (Pram) Persaud) ને ક્રિકેટમાં પોતાના સમર્પણ બદલ બિલ્ડર શ્રેણીમાં સમાવવામાં આવશે. ગત 35 વર્ષ સુધી આ ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી અને વહીવટકર્તાનાની ઓન્ટેરિયોમાં સામેલગીરી પહેલાં તેમની 10 વર્ષ સુધી ક્યુબેકમાં વૃદ્ધિ અને વિકાસ માટે 2020 માં 45 વર્ષની સેવા બદલ તેમને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ક્રિકેટ હોલ ઓફ ફ્રેમમાં સમાવવામાં આવ્યા હતા. તેમણે બ્રેમ્પટનમાં ક્રિકેટના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી છે, જેનાથી ક્રિકેટનું વિસ્તરણ માત્ર પાંચ વર્ષોમાં 15 ક્લબ્સથી 62 ક્લબ્સમાં થયું છે.

પાટ ઓ'ટૂલ (Pat O'Toole) ને લેકોઝમાં પોતાના સમર્પણ બદલ એથલીટ શ્રેણીમાં સમાવવામાં આવશે. તેઓ બ્રેમ્પટનમાં વર્ષ 1998 થી રહે છે, અને તેઓને બોક્સ અને ફીલ્ડ લેકોઝ બંનેમાં ખેલાડી અને કોચ તરીકે નાના, મોટા અને આંતરરાષ્ટ્રીય સ્તરોએ પોતાની ઉપલબ્ધિઓ માટે સન્માન આપવામાં આવ્યું છે. તેઓ રોચેસ્ટર નાઈટહોક્સ સાથે પોતાની 16 માંથી 12 સીઝન્સ રમ્યા, જેઓ સાથે તેઓ હજુ પણ આસિસ્ટન્ટ કોચ તરીકે સક્રિય છે. તેઓ બ્રેમ્પટન માર્શનર લેકોઝ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે.

તમારા તાથમ (Tamara Tatham) ને બાસ્કેટબોલમાં પોતાના સમર્પણ બદલ એથલીટ શ્રેણીમાં સમાવવામાં આવશે. તેણીની આંતરરાષ્ટ્રીય રમત કારકિર્દીમાં 2007 થી શરૂ કરીને કેનેડાનું પ્રતિનિધિત્વ કરીને 164 રમતો, વરિષ્ઠ સ્તરે 157 રમતો સામેલ છે. તેણીએ 2015 FIBA અમેરિકાની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટમાં અને 2015 પેન એમ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તેણી 2012 અને 2016 ઓલિમ્પિક્સમાં પણ રમી છે, અને તેણીએ વિદેશમાં ઘણાં ટાઈટલ્સ જીત્યા છે. તેણીએ નિવૃત્તિ પછી, કોચ તરીકે ઘણી ટીમોને સેવા આપી છે.

દેવ શર્મા (Dev Sharma) ને ટ્રેક એન્ડ ફીલ્ડમાં પોતાના સમર્પણ બદલ વેટરન (પીઠ) શ્રેણીમાં સમાવવામાં આવશે. તેમણે વર્ષ 2015 માં 80 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ, ઘણાં મેડલ્સ જીત્યા છે. વર્ષ 1988 થી 2016 સુધી, તેમણે 203 મેડલ્સ એકઠા કર્યા, જેમાં કેનેડિયન માસ્ટર્સ એથલેટિક્સ ઈનડોર એન્ડ આઉટડોર ચેમ્પિયનશિપ્સ અને ઓન્ટેરિયો માસ્ટર્સ એથલેટિક્સ ઈનડોર એન્ડ આઉટડોર ચેમ્પિયનશિપ્સ સામેલ છે. તેમણે બ્રેમ્પટનમાં 2016 કેનેડા 55+ ગેમ્સ અને બ્રેમ્પટન ડિસ્ટ્રિક્ટ 55+ ગેમ્સમાં સ્પર્ધામાં રહીને મેડલ્સ જીત્યા છે.

વોલી સ્લોકી (Wally Slocki) ને માર્શલ આર્ટ્સમાં પોતાના સમર્પણ બદલ વેટરન (પીઠ) શ્રેણીમાં સમાવવામાં આવશે. તેઓ બ્લેક બેલ્ટ ધરાવે છે જેમણે સ્પર્ધક તરીકે ઘણી ટ્રોફીઓ જીતી છે અને તેમને યુનાઈટેડ સ્ટેટ્સમાંની બધી ટુર્નામેન્ટ્સમાં “લેજેન્ડરી કેનેડિયન” તરીકે ઓળખ મળી હતી. તેઓ વર્ષ 1967, 1968 અને 1970 માં કેનેડિયન ચેમ્પિયનશિપ, અને 1972, 1973 અને 1974 માં ઓન્ટેરિયો ચેમ્પિયનશિપ જીત્યા હતા. સ્લોકીને શીખવવાનો શોખ છે અને 1960 નાં દાયકાના અંતે ડાઉનટાઉન બ્રેમ્પટનમાં ઈસ્ટર્ન કરાટે ખોલી, જે મોડેથી વિસ્તરણ

થઈને કેનેડિયન સ્કૂલ ઓફ હેલ્થ એન્ડ સેલ્ફ ડિકેન્સ તરીકે જાણીતી બની. તેમણે ગ્રાહકલક્ષી કોર્પોરેટ મેનેજમેન્ટ સેમિનાર્સમાં તાલીમ આપવાનું અને શીખવવાનું ચાલુ રાખ્યું છે.

બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ અને તેઓ સાથે સમાવાના સભ્યો વિશે વધુ માહિતી મેળવવા, વેબસાઈટ www.brampton.ca/bshf જુઓ.

બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમની સ્થાપના વર્ષ 1979 માં સીટી ઓફ બ્રેમ્પટન સાથે સંયુક્તપણે રમતો માટે ઉત્સાહિતોના એક સમર્પિત સમૂહ દ્વારા કરવામાં આવી હતી. તે સીએએ સેન્ટરમાં (CAA Centre) 7575 કેનેડી રોડ - દક્ષિણ (Kennedy Road South) પર સ્થિત છે.

2022 ઈન્ડક્શન સેરેમની (સમાવેશ સમારંભ)

41^{મો} વાર્ષિક બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ ઈન્ડક્શન સેરેમની મંગળવાર, મે 3 નાં રોજ સાંજે 6 વાગ્યે ધી રોજ બ્રેમ્પટનમાં યોજાશે, જેમાં સ્પોર્ટ્સનેટ સેન્ટ્રલ એન્ડ સ્પોર્ટ્સનેટ 590 ધી ફેન (The FAN) નાં મુખ્ય વક્તા કેન રીડ (Ken Reid) રહેશે. ટિકિટ્સ \$55 ની છે અને વેબસાઈટ www.rosetheatre.ca પરથી ખરીદી શકાય છે.

2023 માટે નામાંકનો

શું તમે આપણાં શહેરમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર કોઈ વ્યક્તિથી માહિતગાર છો? વર્ષ 2023 માટેનું નોમિનેશન ફોર્મ ડાઉનલોડ કરો! નામાંકનો જૂન 15, 2022 સુધી સ્વીકારવામાં આવશે.

અવતરણો (ક્વોટ્સ):

“વર્ષ 2022 નાં બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ ક્લાસને અભિનંદન! આ વર્ષે સમાવેલા સૌએ આગેવાની દેખાડીને અને સાથે રહીને આપણાં સમુદાયમાં રમતમાં ઉત્કૃષ્ટ ફાળો આપ્યો છે અને ઉપલબ્ધિઓ મેળવી છે. અમને એટલું બધું ગૌરવ થાય છે કે આ સમાવેલી વ્યક્તિઓ બ્રેમ્પટનને ધર કહે છે.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ આપણાં શહેરમાં રમતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું સન્માન કરે છે. 2022 માં સમાવેલી વ્યક્તિઓ પ્રતિષ્ઠિત આગેવાનો છે જેઓ બ્રેમ્પટનમાં પોતાની સમગ્ર રમત કારકિર્દીઓમાં ગૌરવ અને પ્રેરણા લાવ્યા છે. હું આપણાં સમુદાયમાં રમતોની ઉજવણી કરવા મે 3 નાં રોજ આ વર્ષે રૂબરૂમાં યોજનારા ઈન્ડક્શન સેરેમનીમાં હાજર રહેવા દરેક વ્યક્તિને આમંત્રણ આપું છું.”

- *જેફ બોમેન (Jeff Bowman), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; સભ્ય, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ કમિટી, સીટી ઓફ બ્રેમ્પટન*

“વર્ષ 2022 બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં પ્રવેશ મેળવનાર સભ્યોની ઘોષણા કરવામાં અમે રોમાંચ અનુભવીએ છીએ! છ નવી સમાવેલી વ્યક્તિઓ એ છે જેઓ આપણાં સમુદાયમાં રમતોને આગળ ધપાવવા સમર્પિત રહી છે. જો તમે બ્રેમ્પટનમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ ફાળો આપનાર કોઈ વ્યક્તિથી માહિતગાર હો તો 2023 માટે તેઓનું નામાંકન કરાવો.”

- *ડગ વિહલન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, સભ્ય, બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફેમ કમિટી, સીટી ઓફ બ્રેમ્પટન*

“બ્રેમ્પટન સ્પોર્ટ્સ હોલ ઓફ ફ્રેમ આપણાં સમુદાયમાં રમતોની અને બ્રેમ્પટન અને આસપાસમાં એથલેટિક્સને આગળ ધપાવતી ઉત્કૃષ્ટ વ્યક્તિઓની ઉજવણી કરે છે. ઇન્ડક્શન સેરેમની માટે અમારી સાથે મે મહિનામાં જોડાઈ જાવ, અને 2023 માટે કોઈનું નામાંકન કરાવો.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઇન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca